

લેબર ડે 2019 ઈન બ્રેમ્પટન

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 27, 2019) – આ વર્ષે, લેબર ડે સોમવાર, સપ્ટેમ્બર 20 નાં રોજ આવશે. પરિણામ સ્વરૂપે, શહેરની સંખ્યાબંધ સેવાઓ અનુપલબ્ધ રહેશે અથવા ઘટાડેલા સેવા સ્તરો સાથે કાર્યરત રહેશે.

બ્રામ્પટન સીટી હોલ લેબર ડે નિમિત્તે બંધ રહેશે. રહેવાસીઓ આ સમય દરમિયાન રૂબરૂમાં મેરેજ લાઈસન્સીસ મેળવવા અરજી કરી શકશે નહિ, નાગરિક લગ્ન સમારોહોનું બુકિંગ કરાવી શકશે નહિ, પાર્કિંગ ટંડ ચૂકવી શકશે નહિ અથવા પરમીટ્સ મેળવવા કે તાજાં (રિન્યુ) કરાવવા અરજી કરી શકશે નહિ અથવા ધંધાકીય પરવાનાઓ મેળવવા કે તાજાં કરાવવા અરજી કરી શકશે નહીં.

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ અને સીટી ઓફ બ્રેમ્પટન બાય-લો એન્ફોર્સમેન્ટ (પેટા-કાનૂનો અમલ-બજવાળી) સહિતની, સંખ્યાબંધ સેવાઓ રાખેતા મુજબ ચાલુ રહેશે.

કોઈ પૂછપરછો કરવા રહેવાસીઓ 311 નંબર પર અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહારથી) કોલ કરી શકે છે, અથવા એક ઈમેઈલ 311@brampton.ca સરનામે મોકલી શકે છે. અમે પાર્કિંગ, કચરો એકત્રીકરણ, મનોરંજનલક્ષી કાર્યક્રમો અને અન્ય ઘણી બાબતો સહિત, સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલને સંબંધિત બાબતો માટે 24/7 ઉપલબ્ધ હોઈએ છીએ.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ લેબર ડે માટે રવિવાર/રજાના દિવસની સેવાની જેમ ચાલુ રહેશે.

તમામ ટર્મિનલો, અને ક્લાર્ક એન્ડ સેન્ડલવૂડ સગવડોમાં ગ્રાહક સેવા કાઉન્ટર્સ, લેબર ડે નિમિત્તે બંધ રહેશે.

રૂટ અને સમયપત્રક માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઈટ જુઓ, www.bramptontransit.com. રિયલ-ટાઈમ (વાસ્તવિક સમયે) આગામી બસ માહિતી મેળવવા તમારા સ્માર્ટ ફોન કે અન્ય મોબાઈલ સાધન પર વેબસાઈટ nextride.brampton.ca જુઓ. અન્ય ફેરાના આયોજનને લગતા સાધનો માટે વેબસાઈટ www.triplinx.ca અથવા ગૂગલ મેપ્સ જુઓ.

બ્રેમ્પટન રિક્રિએશન

મોટા ભાગની મનોરંજનલક્ષી સગવડો લેબર ડે પર ખુલ્લી રહેશે. અઘતન કાર્યક્રમ સમયપત્રકો અને સંચાલન ક્લાકો માટે, તમારા સ્થાનિક રિક્રિએશન સેન્ટરને ફોન કોલ કરો, 311 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ www.brampton.ca/recreation જુઓ. આ શહેરની રિક્રિએશન એડમિનિસ્ટ્રેશન ઓફિસ લેબર ડે નિમિત્તે બંધ રહેશે.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર લેબર ડે નિમિત્તે બંધ રહેશે. વધુ માહિતી મેળવવા, 905.458.5800 અથવા 311 નંબર પર ફોન કોલ કરો, અથવા વેબસાઈટ જુઓ www.brampton.ca/animalservices.

બ્રેમ્પટન લાઈબ્રેરી

રવિવાર, સપ્ટેમ્બર 1 અને સોમવાર, સપ્ટેમ્બર 2 નાં રોજ બ્રેમ્પટન લાઈબ્રેરીની તમામ શાખાઓ બંધ રહેશે.

तमारी पसंदगीना पुस्तको कोठपाण शाखामां पिक-अप अने रिटर्न करवा ओनलाईन रिजर्व (आरक्षित) करावो. तमारा मकत लाईब्रेरी कार्ड वडे ँ-बूक्स अने घणानो आनंद माणो. वधु माळिती मेणववा वेबसाईट www.bramptonlibrary.ca ळुओ अथवा 905.793.4636 नंबर पर कोव करो.

आतशबाळ सुरक्षा

सीटी ओड् ब्रेम्पटन लेबर डे पर कोठ आतशबाळ प्रदर्शन करशे नई.

लेबर डे वर्ष दरमियानना ऐ चार दिवसो पैकी ऐक नथी ळ्यारे सीटी ओड् ब्रेम्पटनमां अंगत रीते आतशबाळ करवानी छूट आपवामां आवती ढोय. वधु माळिती माटे वेबसाईट ळुओ, www.brampton.ca/bylaws.

-30-

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूडान्मक संवाड

सीटी ओड् ब्रेम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca